

ઘોરણ-૧૦ ની પૂરક પરીક્ષા-૨૦૨૦ માટે આવેદન કરવા માટેની સુચનાઓ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, ઘોરણ-૧૦ ની માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણ પત્રકમાં (NEEDS IMPROVEMENT) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી તૈયાર કરી શાળાઓને માર્ચ-૨૦૨૦ ની પરીક્ષાના પરિણામ સાથે મોકલવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયની પરીક્ષામાં નાપાસ છે અને પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા પરીક્ષાર્થીઓ વર્ષ-૨૦૨૦ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે.

1) અરજી કરવા માટેની પ્રક્રિયા:-

આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. (આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. રૂબરૂ કે ટપાલ દ્વારા આવેદન સ્વીકારવાની પદ્ધતિ હવે પછીથી અમલમાં રહેશે નહીં.)

પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી તા.૦૧/૦૭/૨૦૨૦ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાકથી તા.૧૦/૦૭/૨૦૨૦ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.

2) Login કરવા માટેની પ્રક્રિયા:-

I. શાળા દ્વારા Login કરવાની પ્રક્રિયા:-

શાળાએ Login કરવા માટે પોતાનો ઇન્ડેક્સ નંબર, પાસવર્ડ તથા Captcha Code ભરી Login Button પર ક્લિક કરવું.

II. વિદ્યાર્થી દ્વારા Login કરવાની પ્રક્રિયા:-

વિદ્યાર્થીએ Login કરવા માટે પોતાનો Seat Number, SID Number તથા Captcha Code ભરી Login Button પર ક્લિક કરવું.

3) આવેદન(રજીસ્ટર) કરવા અને ફી ભરવા માટેની પ્રક્રિયા:-

- શાળાએ જે વિદ્યાર્થીનું આવેદન કરી તેની ફી ભરવી છે તે વિદ્યાર્થીના ચેકબોક્ષ ઉપર ક્લિક કરી(વિદ્યાર્થીના નામ સામે ટીકમાર્ક કરી) નીચે “Register and Pay” બટન પર ક્લિક કરી Debit Card/Credit Card, Internet Banking અથવા SBI Branch Payment મારફતે ફી ભરવાની રહેશે.

કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા-૨૦૨૦ માટે ઓનલાઇન આવેદન(રજીસ્ટ્રેશન) કરવું ફરજિયાત છે.

- અંતિમ તારીખ સુધી ફી એક થી વધુ તબક્કામાં પણ ભરી શકાશે.

- COVID-19 ની પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ શાળા પર જઈ આવેદન માટેની સંમતિ તથા ફી ન આપી શકે તેમ હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થી સ્વયં ઓનલાઈન આવેદન કરીને નિયત ફી ભરી શકશે. અને તેઓએ(વિદ્યાર્થીને) તેઓની શાળાને ટેલીફોનિક જાણ કરવાની રહેશે. વિદ્યાર્થી એ પોતાનું આવેદન કરી ફી ભરવા માટે પોતાના નામના સામે આપેલ ચેકબોક્ષ ઉપર ક્લિક કરી નીચે “Register and Pay” બટન પર ક્લિક કરી Debit Card/Credit Card, Internet Banking અથવા SBI Branch Payment મારફતે ફી ભરી શકે છે.

3) આવેદન કરેલ અથવા બાકી રહેલ વિદ્યાર્થીઓની યાદી મેળવવા માટેની પ્રક્રિયા:-

શાળા દ્વારા લોગીન કરી Report Button પર ક્લિક કરી “Student Wise Report” ઉપર ક્લિક કરવાથી જે વિદ્યાર્થીઓનું આવેદન કરી ફી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓનું આવેદન કરવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓની યાદી મેળવી શકાશે.

4) શાળા દ્વારા કરવામાં આવેલ ચૂકવણા(PAYMENT) ની રસીદ(Receipt) મેળવવા માટેની પ્રક્રિયા:-

શાળા દ્વારા લોગીન કરી PAYMENT DETAILS પર ક્લિક કરી “Print Challan” માંથી જે વિદ્યાર્થીઓએ પોતાનું આવેદન કરી ફી ભરી દીધેલ છે તેમની Receipt Download કરી શકશે.

ઘોરણ -૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૦ ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી નીચે મુજબ રહેશે.

૧. રીપીટર (એક વિષય)	રૂ.૧૩૦/- ફી
૨. રીપીટર (બે વિષય)	રૂ.૧૮૫/- ફી

નોંધ:- ઉપરોક્ત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.